



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૭/૦૫/૨૦૧૯ સોમવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૦૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૨૮ કેસ કરી, ૨૩ વ્યક્તિઓને ઝડપી, ૩૫૩ લીટર દેશી દારૂ અને ૨ બોટલ ઇંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગાર ધારા હેઠળ ૨ કેસ કરી ૪ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૭,૬૦૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૦૪/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૪૭ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૧ વ્યક્તિની અટકાયત કરી હતી.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૯૦૫/૧૯

વસ્ત્રાપુર: ધવલ સ/ઓ ગૌતમભાઈ પટેલ (રહે.શંકરદાદા સોસાયટી, કે.કે.નગર રોડ, ઘાટલોડીયા) એ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૫/૦૫/૧૯ રાતના ૯/૩૦ થી તા.૨૬/૦૫/૧૯ કલાક ૧૦/૩૦ વાગ્યા દરમિયાન બોડકદેવ સિંધુભવન રોડ, એશિયન સ્ક્વેર, ગ્રાઉન્ડ ફ્લોર, આઈ વિનસ દુકાન નંબર ૧ અને ૨ ના શટરના તાળા-નકુચા તોડી, અજાણી વ્યક્તિ દુકાનમાં પ્રવેશ કરી, શો રૂમ અને સ્ટોર રૂમમાંથી આશરે ૩૫ જેટલા એપલ કંપનીના ફોન અને હાર્ડવેર કુલ કિંમત રૂપિયા ૪૦,૦૦,૦૦૦/- તથા કેસ કાઉન્ટરના ડ્રોવરમાંથી રોકડ રૂપિયા ૧,૫૦,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૧,૫૦,૦૦૦/-મતાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી એમ.એમ.જાડેજા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૯૦૬/૧૯

રખિયાલ: હસમુખભાઈ મોહનભાઈ પરમાર (ઉ.વ.૪૨) (રહે. સત્યમનગર રબારી વસાહત અમરાઈવાડી) એ અગમ્ય કારણસર તા.૨૬/૦૫/૧૯ રાતના ૦૦/૪૫ વાગ્યાના સુમારે રખિયાલ પાણીની ટાંકી સામે સુખરામનગર સંત વિનોબાભાવેનગર ખાતે રહેતા પોતાના દાદાના ઘરે પ્લાસ્ટીકની સુતળી સીલીંગના હુકમાં બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે રખિયાલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી બળદેવસિંહ રામસિંહ ચલાવે છે.

શાહીબાગ: નિખિલભાઈ પુનમભાઈ યાદવ (ઉ.વ.૨૮) (રહે. પ્રિતમપુરા સોસાયટી વિભાગ-૧ ગીરધરનગર શાહીબાગ) એ અગમ્ય કારણસર તા.૨૬/૦૫/૧૯ કલાક ૬/૦૦ વાગ્યાના સુમારે અંડરબ્રીજ રાણી સતી મંદીર નજીક એસીડ પી લીધું હતું. સારવાર માટે તેમને સીવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે શાહીબાગ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઇ.શ્રી અજીતસિંહ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.